

ત્વરિત જાહેરાત માટે

ત્રીજી બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સગવડ માટે બ્રેમ્પટને \$128 મિલિયનનું

ફેડરલ અને પ્રોવિન્સનું રોકાણ સુરક્ષિત કર્યું

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 15, 2021) – આજે, મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown); બ્રેમ્પટન સીટી કાઉન્સિલર્સ; મનિન્દર સિધુ (Maninder Sidhu), મિનિસ્ટર ઓફ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના સંસદીય સચિવ અને બ્રેમ્પટન ઈસ્ટ માટે સંસદ સભ્યએ, મિનિસ્ટર ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કમ્યુનિટીસ, માનનીય કેથેરિન મૅકેન્ના (Catherine McKenna) વતી; ઓન્ટેરિયોના મિનિસ્ટર ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માનનીય લૉરી સ્કોટ (Laurie Scott) વતી, અમરજોત સંધુ (Amarjot Sandhu), બ્રેમ્પટન વેસ્ટ માટે પ્રોવિન્સિયલ પાર્ટીમેન્ટના સભ્યએ બ્રેમ્પટન ટ્રાન્ઝિટની ત્રીજી સ્ટોરેજ અને મેઈન્ટેનન્સ સગવડ માટે ભંડોળ આપવાની ઘોષણા કરી.

ગવર્મેન્ટ ઓફ કેનેડા ઇન્વેસ્ટિંગ ઇન કેનેડા યોજનાની પબ્લિક ટ્રાન્ઝિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રીમ (PTIS) મારફતે આ પ્રોજેક્ટમાં \$69.9 મિલિયનનું રોકાણ કરી રહ્યું છે. ગવર્મેન્ટ ઓફ ઓન્ટેરિયો \$ 58.2 ઉપરાંતનું ભંડોળ, અને સીટી ઓફ બ્રેમ્પટન \$ 46.6 મિલિયનથી વધારેનો ફાળો પૂરો પાડી રહ્યું છે.

આ પ્રોજેક્ટના તબક્કા 1 માં લગભગ 400,000 ચોરસ ફૂટની ટ્રાન્ઝિટ મેઈન્ટેનન્સ અને સ્ટોરેજ સગવડનું બાંધકામ કરવાનો સમાવેશ થાય છે જેમાં 36 જેટલી મેઈન્ટેનન્સ બે અને લગભગ 40 જેટલા ઓવરહેડ ગેરેજ ડોર્સ રહેશે જે 250 જેટલી સ્ટાન્ડર્ડ 40 ફૂટ સમકક્ષની બસોનો સંગ્રહ કરવા દેશે, જે વહીવટી અને જાળવણી સહાયતા જગ્યા ઉપરાંત રહેશે. કામમાં ફિક્સડ (અચળ) અને મોબાઇલ હોઈસ્ટ્સ, એક વાહન નિરીક્ષણ માટેનો પ્લાટો (પિટ), એક ઓવરહેડ કેન, ઈંધણ સંગ્રહણ અને વિતરણ સિસ્ટમ્સ, વેલિકલ લોકેશન અને રેડિયો સિસ્ટમ, અને બેકઅપ વીજળી ઉત્પાદનનો પણ સમાવેશ થાય છે.

આ નવી સગવડના બાંધકામથી બ્રેમ્પટન માટે પબ્લિક ટ્રાન્ઝિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતા, ગુણવત્તા અને સુરક્ષામાં સુધારો થશે, અને ઇલેક્ટ્રિક બસોની સર્વિસ કરવા માળખાગત સગવડનું ભાવિ ઇન્સ્ટોલેશન થઈ શકશે, જે રહેવાસીઓ માટે વધારે સુઘડ અને બહુ કાર્યક્ષમ પરિવહન પદ્ધતિઓ ઊભી કરશે. સીટી ઓફ બ્રેમ્પટન આ સગવડનું ઇલેક્ટ્રિકીફિકેશન કરવા વધારાના \$150 મિલિયન ભંડોળની માગણી કરી છે.

આ ભંડોળથી સગવડના તબક્કા 1 નાં બાંધકામ ખર્ચોઓ આવરી લેવામાં મદદ મળશે. આ નવી સગવડનું બાંધકામ વર્ષ 2022 માં શરૂ કરીને બે તબક્કાઓમાં કરવાનો લક્ષ્યાંક છે, જેમાં તબક્કો 1 ખોલવાનો અંદાજ વર્ષ 2024 પૂરું થવા સુધીનો રાખવામાં આવ્યો છે.

સીટી માટે હાલમાં આ પ્રોજેક્ટ એન્વિરોન્મેન્ટલ પ્રોજેક્ટ રિપોર્ટ (EPR) નાં સમીક્ષા સમયગાળામાં છે. આ રિપોર્ટ સમીક્ષા માટે એપ્રિલ 19 સુધી વેબસાઇટ Brampton.ca/transitfacility પર રહેશે. પ્રતિભાવ આપવા ઈચ્છતા લોકો પ્રોજેક્ટના યાદીબદ્ધ સંપર્કો સાથે સંકળાઈ શકે છે.

ક્ડીઓ (લિંક્સ)

- [કેનેડા અને ઓન્ટેરિયો બ્રેમ્પટનના રહેવાસીઓ માટે પબ્લિક ટ્રાન્ઝિટની માળખાગત સગવડમાં રોકાણ કરશે](#)
- [ત્રીજી ટ્રાન્ઝિટ સગવડમાં એન્વિરોન્મેન્ટલ પ્રોજેક્ટ રિપોર્ટ \(EPR\) સમીક્ષા સમયગાળો](#)
- [સીટી ઓફ બ્રેમ્પટને શુન્ય-ઉત્સર્જન બસોને સહાયરૂપે ઉત્તમ અમેરિકાની સૌથી વિશાળ ઇલેક્ટ્રિક બસ ટ્રાન્ઝિટ સગવડોમાંની એકનું બાંધકામ કરવાની યોજના બનાવી છે](#)

અવતરણો (ક્વોટ્સ):

“અમે બ્રેમ્પટન ટ્રાન્ઝિટની ત્રીજી સ્ટોરેજ અને મેઈન્ટેનન્સ સગવડમાં ગવર્મેન્ટ ઓફ કેનેડાના અને ગવર્મેન્ટ ઓફ ઓન્ટેરિયોના રોકાણોને આવકારીએ છીએ. બ્રેમ્પટન ટ્રાન્ઝિટ કેનેડામાં સૌથી ઝડપથી વિકાસશીલ ટ્રાન્ઝિટ સિસ્ટમ્સમાંની એક છે અને નવી સગવડ આપણાં પહોંચ સુલભ અને સંકળાયેલા ટ્રાન્ઝિટ નેટવર્કને સહાયરૂપે થવામાં મદદ કરશે અને તેના બાંધકામમાં દર વર્ષે લગભગ 850 નવી નોકરીઓ ઊભી કરશે,

અને સગવડ પૂરેપૂરી બંધાઈ રહે અને સંચાલનમાં હોય ત્યારે આશરે 1,000 નોકરીઓ ઊભી કરશે. એક હરિયાણુ શહેર બનાવવા આપણી કાઉન્સિલની કટિબદ્ધતાને પ્રસ્થાપિત કરવા, અમે સગવડનું ઈલેક્ટ્રિકિફિકેશન કરવા ભંડોળ આપવાનું ચાલુ રાખીએ છીએ.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રેમ્પટન સ્થિરતા-ટકાઉપણમાં અગ્રણી છે અને તે એટલી જ યોગ્ય બાબત છે કે આપણું ટ્રાન્ઝિટ નેટવર્ક સારી રીતે જોડાયેલું અને પર્યાવરણને અનુકૂળ છે. આપણે ઈલેક્ટ્રિક, શૂન્ય-ઉત્સર્જન બસોના કાફલામાં પરિવર્તિત થવાની અને આપણાં કાયમી લક્ષ્યોને સંતોષવાની આશા રાખીએ છીએ ત્યારે, બ્રેમ્પટન ટ્રાન્ઝિટની ત્રીજી સ્ટોરેજ અને મેઈન્ટેનન્સ સગવડ માટે બ્રેમ્પટન સીટી કાઉન્સિલ સરકારના બધાં સ્તરો પાસેથી સહાયતા મેળવવામાં રોમાંચ અનુભવે છે.”

- પૉલ વિસેંટે (Paul Vicente), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; અધ્યક્ષ, પબ્લિક વર્ક્સ એન્ડ એન્જનીયરિંગ, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટી ઓફ બ્રેમ્પટન ટકાઉ અને ઊર્જા-કાર્યક્ષમ ટ્રાન્ઝિટ સિસ્ટમનું નિર્માણ કરવા કટિબદ્ધ છે, અને આ રોકાણો આપણી હરિયાણી પહેલોમાં - ત્રીજી ટ્રાન્ઝિટ સગવડ એવા સીમાચિલ્ન પ્રોજેક્ટને સહાયરૂપ બનશે. અમે બ્રેમ્પટનમાં રોકાણ લાવવા અમારા હિતધારકો સાથે કામ કરવાનું ચાલુ રાખવા આશાવાદી છીએ.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

“આજનું રોકાણ બ્રેમ્પટનની સૌથી વિશાળ મેઈન્ટેનન્સ અને સ્ટોરેજ સગવડ બનાવવામાં મદદરૂપ થશે. આ ખાતરી કરાવશે કે રહેવાસીઓ પાસે આગામી વર્ષોમાં ગુણવત્તાસભર અને સુરક્ષિત પબ્લિક ટ્રાન્ઝિટ વિકલ્પોની પહોંચ રહે છે, સારો પગાર આપતી નોકરીઓ ઊભી કરવાની સાથે સાથે, હરિયાણી અને કાર્બનના નીચા પ્રમાણવાળી ટ્રાન્ઝિટ સિસ્ટમ્સ માટે ભાવી તકો પણ ઊભી કરે છે. કેનેડાનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન હજારો પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે છે, દેશભરમાં રોજગારનું સર્જન કરે છે, અને વધારે સાફ, વધારે સર્વગ્રાહી સમુદાયોનું નિર્માણ કરે છે.”

- માનનીય કેથેરિન મૅકેન્ના (Catherine McKenna), ફેડરલ મિનિસ્ટર ઓફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કમ્યુનિટીસ વતી, મનિન્ડર સિંધુ (Maninder Sidhu), મિનિસ્ટર ઓફ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટના સેક્રેટરી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ ફોર બ્રેમ્પટન ઈસ્ટ

“ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયો આ નિર્ણાયક રોકાણ કરવા આપણાં ફેડરલ અને મ્યુનિસિપલ સાથી કર્મચારીઓ સાથે ભાગીદારી કરીને પ્રોવિન્સમાં ટ્રાન્ઝિટની માળખાગત સગવડ સુધારવા ફરી એકવાર પોતાની કટિબદ્ધતા દર્શાવી રહ્યું છે. નવા ટ્રાન્ઝિટ ટર્મિનલથી બ્રેમ્પટનવાસીઓ માટે અવરજવર કરવામાં ઓછો સમય વિતાવે અને પોતાના કુટુંબીજનો સાથે ઘરે વધારે સમય વિતાવી શકે તેવી અમારી યોજનામાં આ અન્ય એક પગલું છે.”

- માનનીય લૉરી સ્કોટ (Laurie Scott), ઓન્ટેરિયોના મિનિસ્ટર ઓફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વતી અમરજોત સંધુ (Amarjot Sandhu), મેમ્બર ઓફ પ્રોવિન્સિયલ પાર્લામેન્ટ ફોર બ્રેમ્પટન વેસ્ટ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca

ચેન્ટલી ઓબર્ટિન (Chantalle Aubertin)
પ્રેસ સેક્રેટરી (Press Secretary)
ઓફિસ ઓફ ધી મિનિસ્ટર ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કમ્યુનિટીસ
613.941.0660 | chantalle.aubertin@canada.ca

ક્રિસ્ટાઈન બુજોલ્ડ (Christine Bujold)
પ્રેસ સેક્રેટરી (Press Secretary)
ઓફિસ ઓફ ધી ઓનરેબલ લોરી સ્કોટ, ઓન્ટેરિયો'સ મિનિસ્ટર ઓફ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર
416.454.1782 | christine.bujold@ontario.ca

સોફિયા સોસા-ડિઆસ (Sofia Sousa-Dias)
કોમ્યુનિકેશન્સ બ્રાંચ (Communications Branch)
ઓન્ટેરિયો મિનિસ્ટ્રી ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Ontario Ministry of
Infrastructure)
437.991.3391 | sofia.sousa-Dias@ontario.ca

મીડિયા રિલેશન્સ (Media Relations)
ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેનેડા (Infrastructure Canada)
613-960-9251, ટોલ ફ્રી: 18.77.250.7154
ઈમેલ: infc.media.infc@canada.ca
અમને [Twitter](#), [Facebook](#) અને [Instagram](#) પર અનુસરો
વેબ: [ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેનેડા \(Infrastructure Canada\)](#)